

ક્રમાંક/ધ/માધ્ય/પરચ/૨૦૨૧/૧૪૨૭  
કમિશનરશ્રી, શાળાઓની કચેરી  
બ્લોક નં.૯, ડૉ. જીવરાજ મહેતા ભવન,  
ગુ.રા. ગાંધીનગર, તા.૩૦/૦૪/૨૦૨૧

પ્રતિ,  
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,  
તમામ.

મરફારી અને અનુદાનિત  
આપના તાલુકા હેઠળની તમામ માધ્યમિક અને  
ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળ કલ્પા નિમન  
જરૂરી ક્રમમાં આપવા કાર્ય.

સંયુક્ત શિક્ષણ નિયામક (માધ્યમિક)  
કમિશનર શાળાઓની કચેરી  
ગુ.રા., ગાંધીનગર

જા. નં. મકમ/૨૦૨૨/૬૦૩૯  
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,  
જિલ્લા સેવા સદન-૨, બી બ્લોક,  
ત્રીજો માળ, મહાલાઈનજી, સુરત.  
તા. ૩૦/૦૪/૨૦૨૧

પ્રતિ  
આમાર્થશ્રી,  
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ (મરફારી અને અનુદાનિત શાળા તમામ)  
કુલ કાર્ય અને સુચગ્રામ્ય.

સદર પરિચયની અમલવારી આપે.

જિલ્લા શિક્ષણાધિકારી,  
સુરત, જિલ્લો, સુરત.



નોવેલ કોરોના વાઈરસ (Covid-19)ના  
સંક્રમણને નિયંત્રણમાં લાવવા લેવાના થતાં  
નિવારક પગલાંઓ બાબત.

ગુજરાત સરકાર

સામાન્ય વહીવટ વિભાગ

પરિપત્ર ક્રમાંક: પરચ-૧૦૨૦૨૦-૫૦૧-૮

સચિવાલય, ગાંધીનગર.

તા.૩૦/૦૪/૨૦૨૧

વંચાણે લીધા : (૧) આ વિભાગનો સમાન ક્રમાંકનો તા.૧૫/૦૪/૨૦૨૧નો પરિપત્ર.

(૨) આ વિભાગનો સમાન ક્રમાંકનો તા.૨૩/૦૪/૨૦૨૧નો પરિપત્ર

(૩) ગૃહ વિભાગનો તા.૨૭/૦૪/૨૦૨૧ના બે પરિપત્ર ક્રમાંક : વિ-૧ / કઅવ /  
૧૦૨૦૨૦ / ૪૮૨

પરિપત્ર:

રાજ્યમાં કોરોના વાઈરસ (કોવિડ-૧૯)નું સંક્રમણ વધતા તમામ સરકારી / અર્ધસરકારી / બોર્ડ / કોર્પોરેશનની કચેરીઓમાં ફરજ બજાવતાં અધિકારીઓ / કર્મચારીઓને નોવેલ કોરોના વાઈરસ (Covid-19) ચેપી રોગનું સંક્રમણ ન થાય તે માટે પૂરતી તકેદારી લેવાના ભાગરૂપે ઉપર વંચાણમાં લીધેલ ક્રમ (૧) અને (૨) સામેના પરિપત્રથી જરૂરી સૂચનાઓ તા.૧૫/૦૪/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધીના સમયગાળા માટે પરિપત્રિત કરવામાં આવેલ છે.

૨. દરમિયાનમાં ઉપર વંચાણમાં લીધેલ ક્રમ (૩) સામેના ગૃહ વિભાગના બે હુકમોથી કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં સરકારી / અર્ધસરકારી કચેરી, બોર્ડ / કોર્પોરેશનમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી મર્યાદિત કરવાનું સુનિશ્ચિત કરવા નક્કી કરેલ છે.


૩. રાજ્ય સરકાર દ્વારા નોવેલ કોરોના વાઈરસ (Covid-19)ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી જાહેર હિતમાં તા.૦૧/૦૫/૨૦૨૧ થી તા.૧૫/૦૫/૨૦૨૧ સુધી આવશ્યક / તાત્કાલિક સેવા સિવાયની સરકારી કચેરીઓ ૫૦% સ્ટાફ સાથે ચાલુ રાખવા સંબંધમાં નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવે છે.

- રાજ્ય સરકારના વહીવટી વિભાગો અને ખાતાના વડાઓ હસ્તકની કચેરીઓ, અર્ધસરકારી, બોર્ડ/કોર્પોરેશનની કચેરીઓમાં અધિકારી/કર્મચારીઓ સંબંધમાં ૫૦% સુધીનો સ્ટાફ ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. અન્ય અધિકારી/કર્મચારીઓએ ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે તેમજ મોબાઈલ ફોન અને ઈ-મેઈલ પર ઉપલબ્ધ રહેવાનું રહેશે. જો કે જાહેર સેવા વિતરણ સંબંધમાં કોઈ અડચણ ન આવે તે રીતે જરૂરી તમામ સ્ટાફે ઉપસ્થિત રહેવાનું રહેશે.
- રાજ્ય સરકાર હસ્તકની આવશ્યક / તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ કચેરીઓ સિવાયની કચેરીઓમાં ફરજ બજાવતાં દિવ્યાંગ કર્મચારીઓ (Person with disabilities) તથા સગર્ભા મહિલા કર્મચારીઓને ફરજ પર બોલાવવાના રહેશે નહિ. પરંતુ આવા કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે.



- તા.૧૫/૦૫/૨૦૨૧ સુધી તમામ સરકારી કચેરીઓ તમામ શનિ-રવિ બંધ રહેશે.
- કચેરીમાં કર્મચારીઓ / અધિકારીઓની હાજરીના સંબંધમાં દરેક કામના સ્થળે સામાજિક અંતર (Social Distances) જળવાય તે જોવાનું રહેશે.
- નોવેલ કોરોના વાઈરસ (Covid-19)નું સંક્રમણ ન થાય તે માટે અધિકારીઓની રૂબરૂ મુલાકાત, બેઠક વગેરે ટાળી, વીડીયો કોન્ફરન્સ સુવિધાનો વધુમાં વધુ ઉપયોગ થાય તે પ્રકારનું આયોજન કરવા સર્વે વહીવટી વિભાગને જણાવવામાં આવે છે.
- નોવેલ કોરોના વાઈરસ (Covid-19)ના વાયરસના સંક્રમણને ધ્યાને લેતાં વધુમાં વધુ Correspondence સરકારી ઈ-મેઈલ પર થઈ શકે, તે મુજબની વ્યવસ્થા સર્વે વિભાગે ગોઠવવી.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

  
 (કમલ દેસાઈ)  
 અધિક મુખ્ય સચિવ (ક.ગ.)  
 સામાન્ય વહીવટ વિભાગ  
 ગુજરાત સરકાર

પ્રતિ,

- (૧) માન. રાજ્યપાલશ્રીના અગ્ર સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર.
- (૨) માન. મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર.
- (૩) માન. મંત્રીશ્રી/રા.ક.મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ, સ્વર્ણિમ સંકુલ-૧/૨, ગાંધીનગર.
- (૪) માન. વિરોધપક્ષના નેતાશ્રીના અંગત સચિવશ્રી, ગુજરાત વિધાનસભા, સચિવાલય, ગાંધીનગર.
- (૫) મુખ્ય સચિવશ્રીના સંયુક્ત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.
- (૬) સર્વે અધિક મુખ્ય સચિવશ્રી / અગ્ર સચિવશ્રી / સચિવશ્રી, સચિવાલયના સર્વે વિભાગ (તેઓ હસ્તકના ખાતાના વડા તેમજ તાબાની કચેરીઓના ધ્યાને મુકવા સારું.)
- (૭) નિવાસી નાયબ સચિવશ્રી, સા.વ.વિ., સચિવાલય, ગાંધીનગર.
- (૮) નાયબ પોલીસ અધીક્ષકશ્રી (સલામતી શાખા), સચિવાલય, ગાંધીનગર.
- (૯) સામાન્ય વહીવટ વિભાગના સર્વે અધિકારીશ્રી.
- (૧૦) સેક્શન અધિકારીશ્રી (બુથ), સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- (૧૧) સિલેક્ટ ફાઈલ (ટ-શાખા)
- (૧૨) જનરલ સિલેક્ટ ફાઈલ.